



વડોદરા મહાનગરપાલિકા

સીધી ભરતી માટેની જાહેરાત (જાહેરાત ક્રમાંક: ૯૪૫/૨૦૧૮-૧૯)

ક્રમ	જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા
૧	ડે.ચીફ ઓફીસર (ફાયર)	૦૧

૧. શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

૧. બી.એસ.સી. (ફાયર અથવા કેમેસ્ટ્રી અથવા ફીઝીકસ)

અથવા

બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી એન્જીનીયરીંગ) પાસ

અથવા

ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારત/ ઇંગ્લેન્ડના સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડિવીઝનલ ઓફીસર્સ કોર્સ પાસ. ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અન્યથા નિમણુંક મળ્યેથી તે ભાષાનું જ્ઞાન મેળવી લેવાનું રહેશે.

૨. ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ઓછામાં ઓછો ૦૭ (સાત)વર્ષનો અનુભવ હોવો જોઈએ, જે પૈકી ડીવીઝનલ ઓફીસર કોર્સ પાસ કર્યા બાદ ઓછામાં ઓછો ૦૩ વર્ષનો અનુભવ.

૩. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

૨. શારિરીક લાયકાત:

ઉંચાઈ – ઓછામાં ઓછી ૧૬૫ સે.મી.

વજન – ઓછામાં ઓછું ૫૦ કિ.ગ્રા.

છાતી – ઓછામાં ઓછી સામાન્ય- ૮૧ સે.મી. (કુલાવીને ઓછામાં ઓછી ૫ સે.મી. વધવી જોઈએ)

દ્રષ્ટિ – સારી, જો ઉમેદવારને ચશ્મા હોય તો, ઉમેદવાર ચશ્મા વગર દરેક પ્રકારની પ્રાયોગિક ફાયર ફીલ કરી શકવો જોઈએ.

૩. **પગાર ધોરણ:** સાતમા પગાર પંચ મુજબ લેવલ-૯ પે મેટ્રીક્સ (૫૩૧૦૦ – ૧૬૭૮૦૦)

૪. **ઉંમર:** ૪૦ વર્ષથી વધુ નહીં.

જાહેરાતની સામાન્ય જોગવાઈઓ:

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૫-૦૨-૨૦૧૯ (૧૧-૦૦ કલાક) થી તા.૨૫-૦૨-૨૦૧૯ (૨૩-૫૯ કલાક) દરમ્યાન **www.vmc.gov.in** વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ **www.vmc.gov.in** ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. **વયમર્યાદા:** અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
4. **વયમર્યાદામાં છુટછાટ:**
વડોદરા મહાનગર પાલિકા ના કર્મચારીને ઉપલી વય મર્યાદામાં ઉંમરનો બાદ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
5. ગુજરાત સરકારના સરકારી/અર્ધ-સરકારી/સરકાર હસ્તકના કોર્પોરેશન/કંપનીઓમાં સેવા બજાવતાં અધિકારી/કર્મચારીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી વખતે ઉમેદવારે સક્ષમ અધિકારીનું ના-વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
6. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
7. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+ લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ અથવા નિમણુંક થયા તારીખથી ૦૬ માસ સુધીમાં સદર કોર્ષ પાસ કરવાનો રહેશે.
8. **અરજી ફી સ્વીકારવા/જમા કરાવવા અંગે:**
એ. ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઈન જ ભરવાના રહેશે.
બી. ઉમેદવાર જ્યારે VMC વેબસાઈટ પર પોતાની અરજી સબમીટ કર્યા બાદ, તેઓને અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. ફી ની રકમ ફક્ત ઓનલાઈન જ ક્રેડીટ/ડેબિટ/નેટ બેંકિંગ દ્વારા ભરવાની રહેશે. ફી ભર્યા અંગેના ચલણની નકલ મેળવી ઉમેદવારે સાચવી રાખવાની રહેશે, અને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી સમયે કોલલેટર સાથે અચૂક લાવવાની રહેશે. ફી ભરેલ અરજી જ રજિસ્ટર્ડ થશે. ફી ભર્યા વગરની અરજી સીસ્ટમ માં રજિસ્ટર્ડ થશે નહિ.

સી. જો ઉમેદવાર ફી ભર્યાની નકલ તથા એપ્લીકેશન ફોર્મ સાથે નહીં લાવે તો તેવા ઉમેદવારોને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ડી. અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં.

ઈ. **ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા. ૨૫-૦૨-૨૦૧૯ રહેશે.**

એફ. તમે લાયકાત ધરાવો છો કે કેમ ? તેની ખાતરી કર્યા બાદ જ અરજી ફોર્મ તથા ફી ભરવી. લાયકાત ન ધરાવતા હોવા છતાં ફી ભરેલ હોય તેવી અરજી રદ ગણાશે. અરજી ફી ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.

9. ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
10. ઉમેદવારે અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
11. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઈન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
12. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
13. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
14. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સુચના માટે www.vmc.gov.in વેબસાઈટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા.૧૪-૦૨-૨૦૧૯.

ડે.મ્યુનિ.કમિશ્નર
વડોદરા મહાનગરપાલિકા.